https://archive.org/details/bk360/page/n0/mode/1up

1959-06 & 07 -Protest against Ramji Laxman Kaka (360)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજને અપીલ

હાલે સાંભળવા મળ્યું છે જે પીરાણાના કાકા રામજી લખમણમારાજનું નામ ધારણ કરી ફરી કચ્છમાં લાવવા ચળવળીયાઓનો પ્રયાસ સફળ થયો છે તે તા. ૩૦–૬–૫૯ના માનકુવા પધારશે તેવી જાહેરાત કચ્છમિત્ર છાપામાં વાંચી.

આ સમાચારથી સમાજમાં અસંતોષ પેદા થાય તે સ્વભાવીક છે. ૫ થી ૬ વર્ષ પહેલાં કાકા રામજી લખમણને કચ્છમાં લાવેલ ને તે માટે મોટી ખટપટ ઉભી થઈ સરકારને તે માટે પગલાં લેવાં પડયાં આ રીતે એકશાન્તીથી સંપ અને સુલેહથી જે સમાજ પોતાની રીતે ચાલ્યો જતો હોય તો આવી ચળવળ શા માટે ઉભી કરે છે તે સમજાતું નથી.

જ્ઞાતિ પ્રગતીના પંથે:—

સમાજમાં હાલે પાટીદાર બોર્ડીંગ નખત્રાણા, પાટીદાર વાડી ભુજ, ત્થા પાટીદાર વાડી માંડવી, ત્થા જ્ઞાતીમાં સળગતા પ્રશ્નોને હલ કરવા આવા ભારતના સીધ્ધાંતને લાગે વળગે તેવાં કાર્યો–સમાજના અગ્રગણ્ય ભાઇઓ કાર્ય કરી રહયા છે તે જોઇ ચળવળીયાને પોતાનું નાક કાપી અપસુકન કરવા માટે અને અસંતોષ પેદા કરવા માટે નામ ફેરવી કાકાને બદલે મારાજ રામજી લખમણ નામ આપી કચ્છમાં પ્રચાર કરવા માગે છે આ કાકા પીરાણાના ઇમામશાહ બાવાના ગાદીપતી છે ને હિન્દુ સમાજ તજી દરગાહના નિયમ અનુસાર તેની કાયદેસર વીધી કરી ગાદી ઉપર આવે છે અને પીરાણા ધર્મ પળાવવા તેના સાથીદારોના બળથી અજ્ઞાન ભોળા ખેડુત વર્ગને સાચો નક લંકી અવતાર મનાવી હિન્દુ ધર્મની ફરજમાંથી અર્ધ દગ્ધ ધર્મને માર્ગે લઈ જવા પ્રચાર કરે છે. આ ધર્મમાં ન દોરાય તે માટે સમાજ ખુબ જાગૃત છે અને દર વરસે ૧ થી ૨ મંદીરો ઉભાં કરી સનાતન ધર્મને માર્ગે સમાજ જઇ રહી છે તે જગ જાહેર છે આવાં મંદીરો લગભગ ૬૦ થી ૬૨ ઉભાં કરવામાં આવ્યાં છે.

આ જાગૃતી સ્વાર્થી અને જુનવાણી વર્ગને ગળે ઉતરતી નથી અને પોતાની મમતા પોસવા આવાં હથીયાર લાવી જ્ઞાતીમાં અસંતોષ ઉભો કરે છે તો સમાજને અમારી નમ્ર પ્રાર્થના છે જે આવા દંભી, લાલચુ, સ્વાર્થી–ચળવળીઆઓથી જાગૃત રહે ને પોતાનો સાચો સનાતન ધર્મને ન ભુલે. જે જ્ઞાતી પોતાની જાત હિન્દુ ધર્મને ભુલાવી બીજાનો ધર્મ સ્વીકારે તે સમાન બીજો અધર્મ શું. ગમે તેવો ધર્મ સારો હોય તોપણ હિન્દુ ધર્મની ફરજ નહિ ચુકે તેવી અમોને શ્રધ્ધા છે

અને આવા વીધર્મીઓને ઉતેજન નહિ આપે અને પોતાની સ્વ કમાઇ જ્ઞાતીની ભાવી પ્રજા માટે કેળવણીમાં ત્થા દેશ હીતના સારાં કાર્યોમાં તેના પૈસા ખરચે અને આવા નામધારીઓથી જાગૃત રહે તેવી અમારી પ્રાર્થના છે.

લી. જ્ઞાતિ સેવક.
કચ્છ કડવા પાટીદાર સમાજનો અભ્યાસી.

શશી પ્રીન્ટીંગ પ્રેસ, ભુજ–કચ્છ.

realpatidar.com

https://archive.org/details/bk360/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 2.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk360/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.18 16:51:12 +05'30'

realpatidar.com

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજને અપીલ

હાલે સાંભળવા મળ્યું છે જે પીરાણાના કાકા રામજી લખમણમારાજનું નામ ધારણ કરી ફરી કચ્છમાં લાવવા ચળવળીયાઓનો પ્રયાસ સફળ થયો છે તે તા. ૩૦–૬–૫૯ના માનકુવા પધારશે તેવી જાહેરાત કચ્છમિત્ર છાપામાં વાંચી.

આ સમાચારથી સમાજમાં અસંતોષ પેદા થાય તે સ્વભાવીક છે. ૫ થી ૬ વર્ષ પહેલાં કાકા રામજી લખમણને કચ્છમાં લાવેલ ને તે માટે મોટી ખટપટ ઉભી થઈ સરકારને તે માટે પગલાં લેવાં પડયાં આ રીતે એકશાન્તીથી સંપ અને સુલેહથી જે સમાજ પોતાની રીતે ચાલ્યો જતો હોય તો આવી ચળવળ શા માટે ઉભી કરે છે તે સમજાતું નથી.

જ્ઞાતિ પ્રગતીના પંથે:—

સમાજમાં હાલે પાટીદાર બોર્ડીંગ નખત્રાણા, પાટીદાર વાડી ભુજ, તથા પાટીદાર વાડી માંડવી, તથા જ્ઞાતીમાં સળગતા પ્રશ્નોને હલ કરવા આવા ભારતના સીધ્ધાંતને લાગે વળગે તેવાં કાર્યો–સમાજના અગ્રગણ્ય ભાઇઓ કાર્ય કરી રહયા છે તે જોઇ ચળવળીયાને પોતાનું નાક કાપી અપસુકન કરવા માટે અને અસંતોષ પેદા કરવા માટે નામ ફેરવી કાકાને બદલે મારાજ રામજી લખમણ નામ આપી કચ્છમાં પ્રચાર કરવા માગે છે આ કાકા પીરાણાના ઇમામશાહ બાવાના ગાદીપતી છે ને હિન્દુ સમાજ તજી દરગાહના નિયમ અનુસાર તેની કાયદેસર વીધી કરી ગાદી ઉપર આવે છે અને પીરાણા ધર્મ પળાવવા તેના સાથીદારોના બળથી અજ્ઞાન ભોળા ખેડુત વર્ગને સાચો નક લંકી અવતાર મનાવી હિન્દુ ધર્મની ફરજમાંથી અર્ધ દગ્ધ ધર્મને માર્ગે લઈ જવા પ્રચાર કરે છે. આ ધર્મમાં ન દોરાય તે માટે સમાજ ખુબ જાગૃત છે અને દર વરસે ૧ થી ૨ મંદીરો ઉભાં કરી સનાતન ધર્મને માર્ગે સમાજ જઇ રહી છે તે જગ જાહેર છે આવાં મંદીરો લગભગ ૬૦ થી ૬૨ ઉભાં કરવામાં આવ્યાં છે.

આ જાગૃતી સ્વાર્થી અને જુનવાણી વર્ગને ગળે ઉતરતી નથી અને પોતાની મમતા પોસવા આવાં હથીયાર લાવી જ્ઞાતીમાં અસંતોષ ઉભો કરે છે તો સમાજને અમારી નમ્ર પ્રાર્થના છે જે આવા દંભી, લાલચુ, સ્વાર્થી–ચળવળીઆઓથી જાગૃત રહે ને પોતાનો સાચો સનાતન ધર્મને ન ભુલે. જે જ્ઞાતી પોતાની જાત હિન્દુ ધર્મને ભુલાવી બીજાનો ધર્મ સ્વીકારે તે સમાન બીજો અધર્મ શું. ગમે તેવો ધર્મ સારો હોય તોપણ હિન્દુ ધર્મની ફરજ નહિ ચુકે તેવી અમોને શ્રધ્ધા છે

અને આવા વીધર્મીઓને ઉત્તેજન નહિ આપે અને પોતાની સ્વ કમાઇ જ્ઞાતીની ભાવી પ્રજા માટે કેળવણીમાં તથા દેશ હીતના સારાં કાર્યોમાં તેવા પૈસા ખરચે અને આવા નામધારીઓથી જાગૃત રહે તેવી અમારી પ્રાર્થના છે.

લી. જ્ઞાતિ સેવક.
કચ્છ કડવા પાટીદાર સમાજનો અભ્યાસી.

શશી પ્રીન્ટીંગ પ્રેસ, ભુજ–કચ્છ.

realpatidar.com

https://archive.org/details/bk360/page/n3/mode/1up

realpatidar.com

મથલ તા. ૭-૭-૫૯

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજને વિનંતી

ગામ મથલ મધે મળેલ સનાતની સમાજની મીટીંગમાં સર્વાનુમતે થએલ ઠરાવ

ઠ રા વ.

આજની સભા કચ્છના કડવા પાટીદાર સનાતન સમાજને વિનંતી કરે છે જે હાલે કચ્છના પીરાણાના કાકા રામજી લખમણને આપણા જુનવાણી ધરાવતા કેટલાક ભાઇઓ તેમને ખાસ પીરાણેથી કાકા રામજી લખમણને તથા તેના સાથીદારો સહિત એક મંડળ કચ્છમાં પીરાણા ધર્મનો પ્રચાર કરવા આવેલ છે અને કાકા રામજી લખમણના બદલે સાધુ મહારાજ એવું નામ પણ આપવામાં આવ્યું છે. તો સનાતન સમાજના ભાઇઓને વિનંતી કરવામાં આવે છે જે આ કાકો જે ગામમાં જાય ત્યાં તેને તે ગામના તેમને ધર્મને માનનારાઓ તરફથી સામૈયા કે સ્વાગત તથા જમણમાં તથા તેમના પ્રચારમાં જવું નહિ તેમજ સાથ કે સહકાર આપવો નહિ એવું ઠરાવવામાં આવ્યું છે આ નિર્ણય જ્યારથી સનાતન ધર્મની સ્થાપના થઇ ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે તો તેજ ઠરાવને ફરીવાર આપના ધ્યાનમાં મુકવા આ સભા ભલામણ કરે છે.

લી.

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ.

શશી પ્રીન્ટીંગ પ્રેસ, ભુજ–કચ્છ.

realpatidar.com